

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧

અખબારી યાદી

તા.૨૭-૦૯-૨૦૨૨

નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્પાદન કરાતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. જેના અનુસંધાને "જય ખોડિયાર ડેરી ફાર્મ" , (ઉત્પાદન યુનિટ -જે. કે. સ્વીટ) સ્થળ -નંદનવન સોસાયટી માધાપર , જામનગર રોડ , રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્થળ પર કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ જૂની વણવાપરાયેલી મીઠાઈનો જથ્થો રિફ્રેશ કરી ફરીથી માર્કેટમાં વેચાણ માટેના હેતુ સબબ રાખવામાં આવેલ હોવાનું જણાતા સ્થળ પર વાસી અખાદ્ય અંજીર બરફી , ચોકલેટ બરફી તેમજ અન્ય મીઠાઈ અનહાયજિનિક રીતે સ્ટોરેજ કરેલ કુલ 110 KG જથ્થો ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ FSS Act -2006 હેઠળ લાયસન્સિંગ કન્ડિશન મુજબ સ્થળ પર હાયજિનિક સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પરથી ઓરેન્જ ચમચમ -બંગાળી મીઠાઈનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

તેમજ અનુસંધાને "શ્રી જલારામ જાંબુવાળા" , સ્થળ -ભવનાથ પાર્ક , માધાપર ગેઈટ પાસે , જામનગર રોડ , રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્થળ પર ફીઝમાં સંગ્રહ કરેલ મીઠાઈનો જથ્થો રિફ્રેશ કરી ફરીથી માર્કેટમાં વેચાણ માટેના હેતુ સબબ સ્ટોરેજ કર્યા હોવાનું જણાતા

સ્થળ પર વાસી અખાદ્ય પેંડા , કેસર પેંડા , થાબડી, બરફી, અંગુરી પનીર તેમજ અન્ય મીઠાઇ અનહાયજિનિક રીતે સ્ટોરેજ કરેલ કુલ 70 KG જથ્થો તથા 3 KG એક્સપાયરી થયેલ ફૂડ કલર ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ FSS Act -2006 હેઠળ લાયસન્સિંગ કન્ડિશન મુજબ સ્થળ પર હાયજિનિક સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પરથી મોતીયૂર લાડુ- મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

ઉપરોક્ત તમામ કામગીરી નાયબ કમિશ્નર શ્રી (હેલ્થ) આશિષ કુમારની સૂચના અન્વયે ડેઝીએટેડ ઓફિસરશ્રી એ. એન. પંચાલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ.

- નમુનાની કામગીરી :-

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૨ નમૂના લેવામાં આવેલ.

(૧) 'ઓરેન્જ ચમચમ -બંગાળી મીઠાઇ (લુઝ)': સ્થળ - "જય ખોડિયાર ડેરી ફાર્મ" - નંદનવન સોસાયટી માધાપર, જામનગર રોડ, રાજકોટ.

(2) મોતીયૂર લાડુ- મીઠાઇ (લુઝ)': સ્થળ - "શ્રી જલારામ જાંબુવાળા" -ભવનાથ પાર્ક , માધાપર ગેઇટ પાસે, જામનગર રોડ, રાજકોટ.

- ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સદર બજાર , ફૂલછાબ ચોક વિસ્તારમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૯ ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૬ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં ઘી, દૂધ, ઠંડાપીણાં, આઇસક્રીમ, બેકરી

પ્રોડક્ટ, મીઠાઈ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

(૧)S N શોપ આઈસક્રીમ -લાઈસન્સ બાબતે નોટિસ (૨)કક્કડ પ્રોવિઝન સ્ટોર - લાઈસન્સ બાબતે નોટિસ (૩)પંજવાણી મેડિકલ સ્ટોર -લાઈસન્સ બાબતે નોટિસ (૪)ખાન કેટરર્સ - લાઈસન્સ બાબતે નોટિસ (૦૫)ઓમ ચીકી -લાઈસન્સ બાબતે નોટિસ (૦૬)મારૂતિ સિઝન સ્ટોર -લાઈસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

તથા (૦૭)નકલંક ડેરી ફાર્મ (૦૮)અજયભાઈ દૂધ વાળા (૦૯)શ્રી નાથજી ફૂડ & કોલ્ડ્રિંક્સ (૧૦)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૧૧)ભારત સ્વીટ & ફરસાણ (૧૨)બોમ્બે બેકરી (૧૩)રાજેશ ચીકી (૧૪)અમોલા પાન (૧૫)કેશવલાલ ભાણજી (૧૬)જમનાદાસ ચક્રભાઈ & બ્રધર્સ (૧૭)બિસ્મિલ્લ તાવા (૧૮)શ્રી પંચનાથ નમકીન સેન્ટર (૧૯)સંગમ ચીકીની સ્થળ પર ચકાસણી કરેલ.

ડેઝીઝનેટેડ ઓફિસર
રાજકોટ મહાનગરપાલિકા